

No.Gujka/VAT/Check post/form-402-403-405/2014-15/B.160/138

Office of
The Commissioner of Commercial Tax
2nd floor, Rajya Kar Bhavan,
Ashram Road, Ahmedabad.
Date: 3/12/2014

Public Circular

Sub. : Implementations of provisions of Sec. 68, Sec. 69 of Gujarat Value Added Tax Act, 2003 and Rule -51 and Rule -52 of Gujarat Value Added Tax Rules, 2006.

Ref.: (1) Order No. : - GVL/VAT/Sec. 68 and 69(1) Dt. 3/12/2014 of Commissioner of Commercial Tax, Gujarat State, Ahmedabad.
(2) Public Circular No. : Gujka/Check post/form-402/B. 5(1)/06-07/B. 21/18, dated 7/10/2006.
(3) Public Circular No. : Gujka/Check post/form-403/B. 5(1)/06-07/B. 22/19, dated 7/10/2006.
(4) Public Circular No. : Gujka/Check post/form-402/B. 5(2)/06-07/B. 24/20, dated 22/11/2006.
(5) Public Circular No. : Gujka/Check post/form-403/B. 5(2)/06-07/B. 25/21, dated 22/11/2006.
(6) Public Circular No. : Gujka/Check post/form-402/B. 5/07-08/B. 40/35, dated 29/01/2008.
(7) Public Circular No. : Gujka/Check post/form-403/B. 5/07-08/B. 41/36, dated 29/01/2008.
(8) Public Circular No. : Gujka/VAT/402-403/11-12/B. 129-110, Dated 14/02/2012.

As per Sec. 68(3) and Sec. 69(1) of The Gujarat Value Added Tax Act, 2003 and Rule -51 and Rule -52 of The Gujarat Value Added Tax Rules, 2006, the driver or other person in-charge of vehicle carrying goods while going outside the state, entering the state and entering the state from any place outside the state and going to any place outside the state, has to carry prescribed documents and declaration in prescribed form, and to produce the same to the officer in-charge of the check-post or the barrier. For the goods going outside the state form -402 and for goods entering the state form - 403 is prescribed. For movement of goods within the state (intra-state movements of goods) form - 402 is prescribed. Certain goods are declared as specified goods vide Rule -51(1) (b) and Rule - 51(6). System for issuance of form 402 and form 403 for specified goods is fixed vide Public Circulars under reference (2) to (7) and thereafter vide Public Circular under reference 8

system for production of electronically generated (INFORM) 402 and 403 to the officer in-charge of the check-post or the barrier is prescribed.

During transit of goods from any place outside the state and going to any place outside the state, the driver or other person in-charge of vehicle carrying goods has to obtain declaration form 405(transit pass) from the officer in-charge of the first check post or the barrier while entering the state and to produce the same to the officer in-charge of the last check post or the barrier before exiting the state. Presently form 405(transit pass) is issued through manual system.

For the ease of obtaining and verification of form 402, 403 and 405 to be produced at the check post and to avoid unnecessary harassment to the traders and the driver during verification at the check post and to see that goods are carried without any wastage of time circulars cited at reference 2 to 8 are hereby cancelled and vide order at reference (1) for the purpose of rule 51(1)(b) and rule 51(6) of Gujarat Value Added Tax Rules, 2006 all taxable goods are declared as specified goods and for such taxable goods, system is put in place to obtain form or form No. (Unique code) through electronic system from 15/12/2014. Provisions of this system are as under:

- (1) This system is applicable to all taxable goods under the of Gujarat Value Added Tax Act, 2003.
- (2) This system is applicable to form 402 for goods going outside the state, form 403 for goods coming inside the state and form 405 (transit pass) for goods entering the state from any place outside the state and going to any place outside the state.
- (3) The benefit of this system would be available for generating form 402 for intra-state movement of goods.
- (4) Form 402, form 403 and form 405 or form No. (Unique code) will have to be obtained by accessing commercial tax department website and by logging in the system prescribed in user manual for said forms.

- (5) Form 402, form 403 or form No. (Unique code) can also be generated through registered mobile number as per system prescribed in the user manual on the website.
- (6) When Form 402, form 403 and form 405 or form No. (Unique code) is generated from the website of the commercial tax department, information of the same will be provided on the e-mail address or the mobile number shown by the transporter.
- (7) Form 402, form 403 and form 405 or form No. (Unique code) as per the system can also be obtained by the dealer for carriage of tax free goods.
- (8) Under the system, all taxable goods under the Gujarat Value Added Tax Act, 2003 are declared as specified goods. So, prescribed template is to be downloaded for taxable goods (specified goods) and tax free goods (non-specified goods) and details prescribed have to be filled in the said template and the same is to be uploaded.
- (9) The driver or other person in-charge of vehicle carrying goods has to carry documents prescribed for the goods and prescribed Form 402, form 403 or form No. (Unique code) as per the provisions of the Act and produce the same to officer in-charge of the check-post of the check post or the barrier and get verification of the same.
- (10) During transit of goods from any place outside the state and going to any place outside the state, the driver or other person in-charge of vehicle carrying goods has to produce declaration form 405(transit pass) or form No. (Unique code) to the officer in-charge of the check-post of the first check post or the barrier while entering the state and to the officer in-charge of the last check post or the barrier before exiting the state and get verification of the same.
- (11) Validity period of the form 402, form 403, form 405 (transit pass) obtained through this system is prescribed as under to prevent misuse of any type of this facility.

Type of form	Validity period
Form- 402	Up to 72 hours from generating form from the website

	and producing the same to the officer in-charge of the check post or barrier. In case of contingency, when the goods carried is transferred and taken by another vehicle, than in that case, further 72 hours.
Form -403	15 days from generating form from the website and producing the same to the officer in-charge of the check post or barrier.
Form-405 (Transit Pass)	15 days from generating form from the website and producing the same to the officer in-charge of the first check post or barrier.
Form-405 (Transit Pass)	72 hours from production of the form to the officer in-charge of the first check post or barrier and to produce the same to the officer in-charge of the last check post or barrier at exit. In case of contingency, when the goods carried is transferred and taken by another vehicle, than in that case, further 72 hours.

- (12) Upon completion of verification of Form 402, Form 403, Form 405 or Form No. (Unique code) by the officer in-charge of the check post or barrier, the same will be informed through SMS on the mobile number given.
- (13) In cases where form 402, form 403 or form No. (Unique code) is not generated through this system or the form or form No. (Unique code) is not produced before check post officer or if any defect is found as described in Sec.68 (4) (a), goods will be physically verified and during such verification if any defect is found or documents of the goods under transport are not kept, than in such circumstances proceedings will be carried out as provided under sec. 68(4) to sec. 68(7) and shall be liable for proceedings u/s 85 and 86.
- (14) In cases where form 405 (transit pass) or form No. (Unique code) is not kept with the goods under transport through this system or the form or form No. (Unique code) is not produced before check post officer of the last check post before exit from the State or the goods is not as shown in form 405 or form

No. (Unique code), than in such circumstances proceedings will be carried out as provided under sec. 69 (1-a), sec. 69 (2) and shall be liable for proceedings u/s 85 and 86.

(15) Random physical verification of the goods under transport will be carried out. The driver of the vehicle selected for random physical verification, shall have to get it physically verified before the check post officer.

(16) For goods under transport other than by road like railway, port, air cargo, form 402, form 403, form 405 shall have to be generated through this system and registered dealers will have to get form verification from the Commercial Tax Officer of the Unit having jurisdiction of the area and un- registered consignor/ consignee will have to get form verification from the Commercial Tax Officer having jurisdiction over the place of business.

(17) As per provisions of the Central Sales Tax Act, 1956, for inter State transactions of goods, movement of goods from one State to another State is essential. As informed above, form 402 is prescribed for goods going out from Gujarat State. Besides, system to produce and verify prescribed form 402 or form No. (Unique code) before the officer in-charge of the check post or barrier or Commercial Tax Officer of the Unit is also fixed. In cases where prescribed form 402 or form No. (Unique code) is not produced before the competent authority, in that case for inter State transaction of goods, it will be presumed that the goods have not been despatched from Gujarat State and it will be considered as local sales of goods.

All concerned may take note of this circular.

Sd/-
(P.D Vaghela)
Commissioner of Commercial Tax
Gujarat State, Ahmedabad.

N.B: This is a Translation from the Gujarati. The original circular has been signed by the commissioner commercial Tax Gujarat.

ક્રમાંક:ગુજકા/વેટ/ચેકપોષ્ટ/ફોર્મ-૪૦૨-૪૦૩-૪૦૫/૨૦૧૪-૧૫/જા.૧૬૦/૧૩૮

વાણિજ્યિક વેરા કમિશનરની કચેરી,
બીજો માળ, વાણિજ્યિક વેરા ભવન,
આશ્રમ રોડ, અમદાવાદ.

તા. ૩/૧૨/૨૦૧૪

જા હે ર પ રિ પ ત્ર

વિષય:- ગુજરાત મુલ્યવર્ધિત વેરા અધિનિયમ ૨૦૦૩ની કલમ-૬૮, કલમ-૬૯ તથા ગુજરાત મુલ્યવર્ધિત વેરા નિયમો ૨૦૦૬ના નિયમ-૫૧ તથા નિયમ-૫૨ની જોગવાઈઓના અમલ બાબત.

સંદર્ભ:- (૧) વાણિજ્યિક વેરા કમિશનર, ગુજરાત રાજ્ય, અમદાવાદના આદેશ

ક્રમાંક:- GVL/VAT/Sec. 68 and 69/(1) Dt.3/12/2014

(૨) જાહેર પરિપત્ર ક્રમાંક:- ગુજકા/વેટ/ચેકપોષ્ટ/ફોર્મ-૪૦૨/જા.પ.(૧)/ ૦૬-૦૭/ જા. ૨૧/૧૮, તા.૭-૧૦-૨૦૦૬

(૩) જાહેર પરિપત્ર ક્રમાંક:- ગુજકા/વેટ/ચેકપોષ્ટ/ફોર્મ-૪૦૩/જા.પ.(૧)/ ૦૬-૦૭/ જા.૨૨-૧૯, તા.૭-૧૦-૨૦૦૬

(૪) જાહેર પરિપત્ર ક્રમાંક:-ગુજકા/વેટ/ચેકપોષ્ટ/ફોર્મ-૪૦૨/ જા.પ.(૨)/ ૦૬-૦૭/ જા.૨૪-૨૦, તા.૨૨-૧૧-૨૦૦૬

(૫) જાહેર પરિપત્ર ક્રમાંક:-ગુજકા/વેટ/ચેકપોષ્ટ/ ફોર્મ-૪૦૩/જા.પ.(૨)/ ૦૬-૦૭/ જા.૨૫-૨૧, તા.૨૨-૧૧-૨૦૦૬

(૬) જાહેર પરિપત્ર ક્રમાંક:-ગુજકા/વેટ/ચેકપોષ્ટ/ફોર્મ-૪૦૨/જા.પ./૨૦૦૭-૦૮ / જા.૪૦/૩૫, તા.૨૯-૧-૨૦૦૮

(૭) જાહેર પરિપત્ર ક્રમાંક:-ગુજકા/વેટ/ચેકપોષ્ટ/ફોર્મ-૪૦૩/જા.પ./૨૦૦૭-૦૮ /જા.૪૧/૩૬, તા.૨૯-૧-૨૦૦૮

(૮) જાહેર પરિપત્ર ક્રમાંક:- ગુજકા/ વેટ/૪૦૨-૪૦૩ / ૧૧-૧૨ /જા.૧૨૯-૧૧૦, તા.૧૪-૨-૨૦૧૨.

ગુજરાત મુલ્યવર્ધિત વેરા અધિનિયમ ૨૦૦૩ની કલમ-૬૮ની પેટા કલમ-(૩) તથા કલમ-૬૯ની પેટા કલમ (૧) તેમજ ગુજરાત મુલ્યવર્ધિત વેરા નિયમો ૨૦૦૬ના નિયમ-૫૧ તથા નિયમ-૫૨ મુજબ રાજ્યમાંથી બહાર જતા, રાજ્યની અંદર દાખલ થતા તેમજ રાજ્ય બહારના કોઈપણ સ્થળેથી રાજ્યમાં પ્રવેશીને રાજ્ય બહારના કોઈપણ સ્થળે જતા માલના વહન દરમિયાન માલ વાહકે અથવા માલનો હવાલો ધરાવતા વ્યક્તિએ માલને લગતા ઠરાવેલા દસ્તાવેજો તથા ઠરાવેલા નમુના મુજબના ડેકલેરેશન સાથે રાખીને ચેકપોસ્ટ ખાતે અથવા બેરીયરનો હવાલો ધરાવતા અધિકારી સમક્ષ રજૂ કરવાના રહે છે. રાજ્ય બહાર જતા

માલ માટે ફોર્મ-૪૦૨ તથા રાજ્યમાં આવતા માલ માટે ફોર્મ-૪૦૩ ઠરાવવામાં આવેલ છે. રાજ્યની અંદર થતા માલના પરિવહન (Intra- State movement of goods) માટે ફોર્મ-૪૦૨ ઠરાવવામાં આવેલ છે. ગુજરાત મુલ્યવર્ધિત વેરા નિયમો ૨૦૦૬ના નિયમ-૫૧ના પેટા નિયમ (૧)ના કલોઝ (બી) તથા પેટા નિયમ (૬) મુજબ કેટલાક માલને નિર્દિષ્ટ માલ જાહેર કરવામાં આવેલ છે. સંદર્ભ-(૨) થી સંદર્ભ-(૭) સામે દર્શાવેલ જાહેર પરિપત્રોથી નિર્દિષ્ટ જાહેર કરેલ માલ માટે ફોર્મ-૪૦૨ તથા ફોર્મ-૪૦૩ ઇસ્યુ કરવાની પદ્ધતિ ઠરાવવામાં આવેલ છે તેમજ ત્યારબાદ સંદર્ભ-(૮) સામે દર્શાવેલ જાહેર પરિપત્રથી સદરહુ નિર્દિષ્ટ જાહેર કરેલ માલ માટે ઇલેક્ટ્રોનિકલી જનરેટેડ (INFORM) ફોર્મ-૪૦૨ તથા ફોર્મ-૪૦૩ ચેકપોસ્ટ અથવા બેરીયરનો હવાલો ધરાવતા અધિકારી સમક્ષ રજૂ કરવાની પદ્ધતિ ઠરાવવામાં આવેલ છે.

રાજ્ય બહારના કોઇપણ સ્થળેથી રાજ્યમાં પ્રવેશીને રાજ્ય બહારના કોઇપણ સ્થળે જતા માલના વહન દરમિયાન માલ વાહકે અથવા માલનો હવાલો ધરાવતી વ્યક્તિએ રાજ્યમાં તેના પ્રવેશ પછીની પ્રથમ ચેકપોસ્ટ અથવા બેરીયરનો હવાલો ધરાવતા અધિકારી પાસેથી માલને લગતું ડેકલેરેશન ફોર્મ-૪૦૫ (ટ્રાન્ઝીટ પાસ) મેળવીને નિર્દિષ્ટ કરેલ રાજ્ય બહાર નીકળવાની છેલ્લી ચેકપોસ્ટ અથવા બેરીયરનો હવાલો ધરાવતા અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહે છે. હાલમાં ફોર્મ-૪૦૫ (ટ્રાન્ઝીટ પાસ) મેન્યુઅલ પદ્ધતિથી ઇસ્યુ કરવામાં આવે છે.

ચેકપોસ્ટ ખાતે રજૂ કરવાના ફોર્મ-૪૦૨, ફોર્મ-૪૦૩ તથા ફોર્મ-૪૦૫ અંગે હાલની પદ્ધતિમાં ફોર્મ મેળવવાની તથા ફોર્મની ચકાસણીની કામગીરીમાં સરળતા રહે તેમજ વેપારી વર્ગ તથા માલ વાહકને ચેકપોસ્ટ ખાતે ચકાસણીની કામગીરીમાં બિનજરૂરી કનડગત કે સમય વેડફાયા વગર માલનું પરિવહન થઇ શકે તે આશયથી ઉક્ત ક્રમાંક-(૨)થી (૮) માં દર્શાવેલ પરિપત્રો રદ કરવામાં આવે છે અને સંદર્ભ-(૧) સામે દર્શાવેલ આદેશથી ગુજરાત મુલ્યવર્ધિત વેરા નિયમો ૨૦૦૬ના નિયમ-૫૧ના પેટા નિયમ (૧)ના કલોઝ (બી) તથા પેટા નિયમ (૬) ના હેતુ માટે તમામ કરપાત્ર માલને નિર્દિષ્ટ માલ જાહેર કરીને સદરહુ કરપાત્ર માલ માટે તારીખ.૧૫-૧૨-૨૦૧૪ થી ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ફોર્મ અથવા ફોર્મનો નંબર (યુનિક કોડ) મેળવવાની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવેલ છે. આ પદ્ધતિની જોગવાઈઓ નીચે મુજબ છે.

- (૧) આ પદ્ધતિ ગુજરાત મુલ્યવર્ધિત વેરા અધિનિયમ-૨૦૦૩ હેઠળના તમામ કરપાત્ર માલને લાગુ પડે છે.
- (૨) આ પદ્ધતિ રાજ્ય બહાર જતા માલ માટે ફોર્મ-૪૦૨, રાજ્યમાં આવતા માલ માટે ફોર્મ-૪૦૩ તથા રાજ્ય બહારના કોઇપણ સ્થળેથી રાજ્યમાં પ્રવેશીને રાજ્ય બહારના કોઇપણ સ્થળે જતા માલ માટે ફોર્મ-૪૦૫ (ટ્રાન્ઝીટ પાસ)ને લાગુ પડે છે.

- (૩) આ પદ્ધતિ મુજબ ફોર્મ-૪૦૨ જનરેટ કરવાની સવલતનો લાભ રાજ્યની અંદર થતા માલના પરિવહન (Intra- State movement of goods) માટે પણ લઈ શકાશે.
- (૪) આ પદ્ધતિથી ફોર્મ અથવા ફોર્મનો નંબર (યુનિક કોડ) મેળવવા માટે ઇન્ટરનેટની મદદથી વાણિજ્યિક વેરા વિભાગની વેબસાઇટ પર જઈને વેબસાઇટ પર દર્શાવેલ ફોર્મ-૪૦૨, ફોર્મ-૪૦૩ તથા ફોર્મ-૪૦૫ (ટ્રાન્ઝીટ પાસ)ના યુઝર મેન્યુઅલમાં ઠરાવેલ પદ્ધતિ મુજબ લોગ ઇન થઈને સદરહુ ફોર્મ અથવા ફોર્મનો નંબર(યુનિક કોડ) મેળવવાનો રહેશે.
- (૫) ફોર્મ-૪૦૨, ફોર્મ-૪૦૩ અથવા સદરહુ ફોર્મના નંબર(યુનિક કોડ) વેબસાઇટ પર દર્શાવેલ યુઝર મેન્યુઅલમાં ઠરાવેલ પદ્ધતિ મુજબ રજીસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા પણ જનરેટ કરી શકાશે.
- (૬) વાણિજ્યિક વેરા વિભાગની વેબ સાઇટ પરથી ફોર્મ-૪૦૨, ફોર્મ-૪૦૩, ફોર્મ-૪૦૫ (ટ્રાન્ઝીટ પાસ) અથવા સદરહુ ફોર્મનો નંબર(યુનિક કોડ) જનરેટ કરવામાં આવે ત્યારે માલ વાહકે દર્શાવેલ ઇ-મેઇલ એડ્રેસ (electronic mail Address) પર તેમજ દર્શાવેલ મોબાઇલ નંબર પર તેની જાણ કરવામાં આવશે.
- (૭) વેપારીશ્રી કરમુક્ત માલના વહન માટે પણ આ પદ્ધતિ મુજબનું ફોર્મ-૪૦૨, ફોર્મ-૪૦૩, ફોર્મ-૪૦૫ (ટ્રાન્ઝીટ પાસ) અથવા સદરહુ ફોર્મનો નંબર(યુનિક કોડ) મેળવી શકે છે.
- (૮) આ પદ્ધતિમાં ગુજરાત મુલ્યવર્ધિત વેરા અધિનયમ-૨૦૦૩ હેઠળ જાહેર કરેલ તમામ કરપાત્ર માલને સ્પેસીફાઇડ ગુડ્ઝ તરીકે જાહેર કરવામાં આવેલ છે. આથી માલના પ્રકાર મુજબ કરપાત્ર માલ (સ્પેસીફાઇડ ગુડ્ઝ) તેમજ કરમુક્ત માલ (નોનસ્પેસીફાઇડ ગુડ્ઝ) માટે ઠરાવેલ ટેમ્પલેટ ડાઉન લોડ કરીને સદરહુ ટેમ્પલેટમાં ઠરાવેલ વિગતો ભરીને તેને અપલોડ કરવાનું રહેશે.
- (૯) માલ વાહકે અથવા માલનો હવાલો ધરાવનાર વ્યક્તિએ આ કાયદાની જોગવાઈ અનુસાર માલને લગતા ઠરાવેલ દસ્તાવેજો તથા ઠરાવેલા નમુના મુજબના ફોર્મ-૪૦૨, ફોર્મ-૪૦૩ અથવા સદરહુ ફોર્મનો નંબર (યુનિક કોડ) સાથે રાખવાના રહેશે તથા ચેકપોસ્ટ અથવા બેરીયરનો હવાલો ધરાવતા અધિકારી સમક્ષ રજુ કરીને તેની અચૂક ખરાઈ (Verification) કરાવવાની રહેશે.
- (૧૦) રાજ્ય બહારના કોઇપણ સ્થળેથી રાજ્યમાં પ્રવેશીને રાજ્ય બહારના કોઇપણ સ્થળે જતા માલના વહન દરમ્યાન માલ વાહકે અથવા માલનો હવાલો ધરાવતી વ્યક્તિએ રાજ્યમાં તેના પ્રવેશ પછીની પ્રથમ ચેકપોસ્ટ અથવા બેરીયરનો હવાલો ધરાવતા અધિકારી સમક્ષ તેમજ નિર્દિષ્ટ કરેલ રાજ્ય બહાર નીકળવાની છેલ્લી ચેકપોસ્ટ અથવા બેરીયરનો હવાલો ધરાવતા અધિકારી સમક્ષ ફોર્મ-૪૦૫ (ટ્રાન્ઝીટ પાસ) અથવા ફોર્મ-૪૦૫નો ફોર્મ નંબર (યુનિક કોડ) રજૂ કરવાનો રહેશે તેમજ સદરહુ અધિકારી સમક્ષ તેની અચૂક ખરાઈ (Verification) કરાવવાની રહેશે.

(૧૧) આ પદ્ધતિ મુજબ મેળવેલ ફોર્મ-૪૦૨, ફોર્મ-૪૦૩, ફોર્મ-૪૦૫(ટ્રાન્ઝીટ પાસ)ની સવલતનો કોઇપણ પ્રકારનો દુરુપયોગ ન થાય તે હેતુથી ફોર્મની વેલીડીટીનો સમયગાળો નીચે મુજબ ઠરાવવામાં આવે છે.

ફોર્મનો પ્રકાર	વેલીડીટીનો સમયગાળો
ફોર્મ-૪૦૨	વેબસાઇટ પરથી ફોર્મ જનરેટ કર્યાના સમયથી ચેકપોસ્ટ અથવા બેરીયરનો હવાલો ધરાવતા અધિકારી સમક્ષ ફોર્મ રજૂ કરવા સુધીનો સમયગાળો ૭૨ કલાક. આકસ્મિક સંજોગોમાં વહન થતો માલ મૂળ વાહનમાંથી તબદિલ કરીને અન્ય વાહનમાં લઇ જવામાં આવે તે કિસ્સામાં વધુ ૭૨ કલાકનો સમયગાળો.
ફોર્મ-૪૦૩	વેબસાઇટ પરથી ફોર્મ જનરેટ કર્યાના સમયથી ચેકપોસ્ટ અથવા બેરીયરનો હવાલો ધરાવતા અધિકારી સમક્ષ ફોર્મ રજૂ કરવા સુધીનો સમયગાળો ૧૫ દિવસ.
ફોર્મ-૪૦૫ (ટ્રાન્ઝીટ પાસ)	વેબસાઇટ પરથી ફોર્મ જનરેટ કર્યાના સમયથી રાજ્યમાં પ્રવેશ પછીની પ્રથમ ચેકપોસ્ટ અથવા બેરીયરનો હવાલો ધરાવતા અધિકારી સમક્ષ ફોર્મ રજૂ કરવા સુધીનો સમયગાળો ૧૫ દિવસ.
ફોર્મ-૪૦૫ (ટ્રાન્ઝીટ પાસ)	રાજ્યમાં પ્રવેશ પછીની પ્રથમ ચેકપોસ્ટ અથવા બેરીયરનો હવાલો ધરાવતા અધિકારી સમક્ષ ફોર્મ રજૂ કર્યાના સમયથી રાજ્ય બહાર નીકળવાની છેલ્લી ચેકપોસ્ટ અથવા બેરીયરનો હવાલો ધરાવતા અધિકારી સમક્ષ ફોર્મ રજૂ કરવા સુધીનો સમયગાળો ૭૨ કલાક. આકસ્મિક સંજોગોમાં વહન થતો માલ મૂળ વાહનમાંથી તબદિલ કરીને અન્ય વાહનમાં લઇ જવામાં આવે તે કિસ્સામાં વધુ ૭૨ કલાકનો સમયગાળો.

(૧૨) ચેકપોસ્ટ અથવા બેરીયરનો હવાલો ધરાવતા અધિકારી દ્વારા વાહન ચાલકે રજૂ કરેલ ફોર્મ-૪૦૨, ફોર્મ-૪૦૩, ફોર્મ-૪૦૫ અથવા સદરહુ ફોર્મના નંબર (યુનિક કોડ)નું વેરીફિકેશન પૂર્ણ થયેથી તેની જાણ દર્શાવેલ મોબાઇલ નંબર પર SMS થી કરવામાં આવશે.

(૧૩) આ પદ્ધતિ મુજબ ફોર્મ-૪૦૨, ફોર્મ-૪૦૩ અથવા સદરહુ ફોર્મના નંબર (યુનિક કોડ) જનરેટ કરવામાં આવેલ નહીં હોય અથવા ચેકપોસ્ટ અધિકારી સમક્ષ ફોર્મ અથવા ફોર્મનો નંબર (યુનિક કોડ) રજૂ કરવામાં આવેલ નહીં હોય અથવા કલમ-૬૮(૪)(ક) માં દર્શાવેલ કોઇ ક્ષતિ માલુમ પડશે તો માલની ભૌતિક ચકાસણી કરવામાં આવશે અને સદરહુ ચકાસણી દરમ્યાન કોઇ ક્ષતિ માલુમ પડશે અથવા માર્ગસ્થ માલ સાથે ઠરાવેલ દસ્તાવેજો રાખેલ નહીં હોય તે સંજોગોમાં કલમ-૬૮ (૪) થી કલમ-૬૮(૭) ની જોગવાઇ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ કલમ-૮૫ તેમજ કલમ-૮૬ હેઠળની કાર્યવાહીને પાત્ર થશે.

(૧૪) આ પધ્ધતિ મુજબ રાજ્યમાં પરિવહન દરમ્યાન માર્ગસ્થ માલ સાથે ફોર્મ-૪૦૫ (ટ્રાન્ઝીટ પાસ) અથવા સદરહુ ફોર્મનો નંબર(યુનિક કોડ) રાખવામાં આવેલ નહીં હોય અથવા રાજ્ય બહાર નીકળવાની છેલ્લી ચેકપોસ્ટ અથવા બેરીયરનો હવાલો ધરાવતા અધિકારી સમક્ષ ફોર્મ-૪૦૫ અથવા સદરહુ ફોર્મનો નંબર (યુનિક કોડ) રજૂ કરવામાં ન આવે અથવા માર્ગસ્થ માલ, ફોર્મ-૪૦૫ અથવા ફોર્મનો નંબર (યુનિક કોડ) મુજબનો જણાય નહીં તે સંજોગોમાં કલમ-૬૯ની પેટા કલમ (૧-ક), કલમ-૬૯ની પેટા કલમ-(૨)ની જોગવાઈ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ કલમ-૮૫ તેમજ કલમ-૮૬ હેઠળની કાર્યવાહીને પાત્ર થશે.

(૧૫) વહન થતા વાહનની રેન્ડમ ભૌતિક ચકાસણી (Physical verification) કરવામાં આવશે. જે વાહન રેન્ડમ ભૌતિક ચકાસણીમાં પસંદ થયેલ હોય તે વાહનના વાહન ચાલકે ચેકપોસ્ટ અધિકારી સમક્ષ વહન થતા માલની ભૌતિક ચકાસણી કરાવવાની રહેશે.

(૧૬) માર્ગ સિવાય (other than by road) અન્ય રીતે જેમ કે, રેલ્વે, પોર્ટ, એર કાર્ગોથી વહન થતા માલ માટે પણ આ પધ્ધતિ મુજબ ફોર્મ-૪૦૨, ફોર્મ-૪૦૩, ફોર્મ-૪૦૫ જનરેટ કરવાના રહેશે તથા ફોર્મનું વેરીફિકેશન નોંધાયેલ વેપારીઓએ તેઓના ઘટકના કાર્યક્ષેત્ર હેઠળના વાણિજ્યિક વેરા અધિકારી સમક્ષ કરાવવાનું રહેશે તેમજ બિન નોંધાયેલ કન્સાઇનર/કન્સાઇનીએ ફોર્મનું વેરીફિકેશન તેઓના ધંધાના સ્થળની હકુમત ધરાવતા વાણિજ્યિક વેરા અધિકારી સમક્ષ કરાવવાનું રહેશે.

(૧૭) કેન્દ્રિય વેચાણ વેરા અધિનિયમ-૧૯૫૬ ની જોગવાઈ મુજબ માલના આંતર-રાજ્ય વ્યવહારો માટે માલની એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં હેરફેર થવી જરૂરી છે. ઉપર જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાંથી બહાર જતા માલ માટે ફોર્મ-૪૦૨ ઠરાવવામાં આવેલ છે. વધુમાં નિયત કરેલ ફોર્મ-૪૦૨ અથવા સદરહુ ફોર્મના નંબર (યુનિક કોડ) ચેકપોસ્ટ અથવા બેરીયરનો હવાલો ધરાવતા અધિકારી સમક્ષ અથવા ઘટકના વાણિજ્યિક વેરા અધિકારી સમક્ષ રજૂ કરવાની અને ખરાઈ કરવાની પધ્ધતિ પણ નિયત કરેલ છે. જે કિસ્સામાં નિયત કરેલ ફોર્મ-૪૦૨ અથવા સદરહુ ફોર્મના નંબર (યુનિક કોડ) સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરવામાં નહીં આવે તે કિસ્સામાં માલના આંતર-રાજ્ય વ્યવહારો માટે માલની ગુજરાત રાજ્ય બહાર રવાનગી થયેલ નથી તેવું ગણવામાં આવશે તથા માલના સ્થાનિક વેચાણો થયેલ છે તેમ ગણવામાં આવશે.

આ પરિપત્રની સંબંધિત સર્વેએ નોંધ લેવી.

સહી/-

(પી.ડી.વાઘેલા)

વાણિજ્યિક વેરા કમિશનર,
ગુજરાત રાજ્ય, અમદાવાદ.

નકલ રવાના:- (માર્ગદર્શન તથા જરૂરી કાર્યવાહી અર્થે)

૧. અધિક સચિવશ્રી(કર) નાણાં વિભાગ, સચિવાલય, ગાંધીનગર.(બે નકલ)
૨. વાણિજ્યિક વેરા કમિશનરશ્રીના રહસ્ય સચિવશ્રી, અમદાવાદ.
૩. ખાસ વાણિજ્યિક વેરા કમિશનરશ્રીના રહસ્ય સચિવશ્રી, અમદાવાદ.
૪. અધિક વાણિજ્યિક વેરા કમિશનરશ્રીના અંગત મદદનીશશ્રી, અમદાવાદ.
૫. સઘના અધિક/સંયુક્ત વાણિજ્યિક વેરા કમિશનરશ્રી.
૬. સઘના નાયબ વાણિજ્યિક વેરા કમિશનરશ્રી.
૭. સઘના સહાયક વાણિજ્યિક વેરા કમિશનરશ્રી.
૮. સઘના વાણિજ્યિક વેરા અધિકારીશ્રી.
૯. સઘની વાણિજ્યિક વેરા કચેરી.
૧૦. ૧૦ નકલ મહાપાત્ર તાલીમશાળા.
૧૧. ૧૦ નકલ દફતર શાખા.
૧૨. ૧૦ જનસંપર્ક શાખા.
૧૩. આ કચેરીની સઘની શાખાઓ.
૧૪. એકાઉન્ટન્ટ જનરલ અમદાવાદ.
૧૫. ઈ-ગવર્નન્સ શાખાને વેબસાઈટ પર મુકવા અર્થે.
૧૬. સઘના નોંધાયેલ વેપારી મંડળો/એસોસીએશન.

(સી.બી.મંડોડી)

સંયુક્ત વાણિજ્યિક વેરા કમિશનર (કાયદા)
ગુજરાત રાજ્ય, અમદાવાદ.